

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination**Feb/Mar. -2021 (NEW COURSE)****Auditing and Corp. Governance - 1(Dse-1)****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ ચાલુ ઓડિટ અને વાર્ષિક ઓડિટની વ્યાખ્યા આપો. વાર્ષિક ઓડિટના ફાયદા અને ગેરફાયદા (૧૪)
જણાવો.
- પ્રશ્ન.૨ આંતરિક અંકુશ એટલે શું? તેના ફાયદા અને મર્યાદા જણાવો. (૧૪)
- પ્રશ્ન.૩ મિલકતોની ચકાસણી એટલે શું? મિલકતોની ચકાસણી અને મૂલ્યાંકન વખતે ઓડિટરે ધ્યાનમાં (૧૪)
લેવાનાં મુદ્દાઓ જણાવો.
- પ્રશ્ન.૪ કોર્પોરેટ ગવર્નન્સના વિવિધ સિદ્ધાંતો જણાવો. (૧૪)
- પ્રશ્ન.૫ ટૂંકનોંધ લખો. (કોઇપણ બે) (૧૪)
1. ઓડિટીંગનું મહત્વ
 2. રોકડવેચાણ અંગે આંતરિક અંકુશ
 3. નીચેનાની ચકાસણી તમે કેવી રીતે કરશો? (ગમે તે બે)
(૧) પાઘડી (૨) રોકાણો (૩) રોકડ સિલક (૪) આખર સ્ટોક
 4. કેતન પારેખ કૌભાંડ

ENGLISH VERSION

- Q.1 Define continuous audit and annual audit. State advantages and disadvantages of annual audit. (14)
- Q.2 What is internal check? State its advantages and limitations. (14)
- Q.3 What is the meaning of verification of assets? State the points should be kept in mind by the auditor while verification and valuation of assets. (14)
- Q.4 Explain the different principles of corporate governance. (14)
- Q.5 Write short notes. (any two) (14)
1. Importance of Auditing
 2. Internal check for cash sales
 3. How would you verify the following (any two)
(1) Goodwill (2) Investments (3) Cash balance (4) Closing stock
 4. Ketan Parekh Scandal
